

## રોટી કાર્યકમનું પ્રોસેસ ડોક્યુમેન્ટેશન



“રોટી કાર્યકમની તાતીમે મારા માટે રોજગારીની નવી તકો ઉભી કરી છે. આ તાતીમ લીધાપણી મને લાગે છે કે હું હવે કોઈ પણ ઘણ્ઠર બ્યુ આપી શકીશા. સીટેયાં મેળેજમેન્ટની તાતીમે મને નવી રેસા આપી છે.” - પીંકીલેન, ગ્રામ -મોટી આડરજ, જુદ્ધાલો- ગાંધીનગર.

## સેવામાં તાલીમ કાર્યક્રમ ૧

સેવા વર્ષ ૧૯૭૨થી અસંગાઈટ વગના બહેનોને સંગાઈટ કરી તેમના રોજગારી સાથે જોડાએલા પ્રણોને વાચા આપે છે અને નકકર પગલાં લે છે. આ કામ કરતાં કરતાં સેવામાં ૧૧ સવાલો જોડાયા. તેમાં છેલે જોડાએલો શિક્ષણનો સવાલ બહુ અગત્યાનો છે. બહેનો જ્યારે સેવામાં જોડાઈ એ વખતે કચાં તો ઓછું ભણેલી હતી અને કચાંતો અભણ હતી. કામ કરવામાંજેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમને શિક્ષણનું મહત્વ સમજાયું. તેઓ જરૂર પુરતું લખતાં વાંચતાં થયા અને પોતાના બાળકોને ભણાવતાં થયા.

આ નવી પેટી જે તૈયાર થઇ તેમની જરૂરીયાતો તેમની મા, નાની અને દાદીયી અતગા જ હતી. તેમને ખેતરમાં કામ નહૃતું કરતું, તેમને કઢિયાકામ, અગરબટી કે બીડી ન હતી બનાવવી. કાગળ વિણવા ન હતું જરૂરું, તેમને તો પોતાનામાં કોઇ ક આવડત વિકસાવી સારી જગાયે કામ કરતું હતું જચાં તેમને કપડાં ન બંગડે, સ્વાસ્થ્યને નુકશાનના થાય અને કાયમી રોજગારી મળે. બહેનોના પાતિનિધિ મિલનમાં, દંધા સમિતિની મિટીગોમાં, નવી પેટીની બહેનો સાથેની મિટીગોમાં, જ્ઞાન વિજ્ઞાન કેન્દ્રો પર અને અમદાવાદ શહેરના શાંતિપથ કેન્દ્રો પર તાલીમ લેવા આવનાર દીકરીઓ પણ વારંવાર કહેતી કે અમારે નર્સીંગનો કોઈ કરવો છે, રેસ્ટોરન્ટમાંકે હોટલમાં, મોલમાં કામ કરતું છે કે કોમ્પ્યુટર શીખી ડેટા એન્ટ્રી ઓપરેટર બનતું છે. પોતાની ઓળખ ઊભી થાય એ રીતે કામ કરતું છે.

સેવા પોતાના રોજગાર સેતુ કાર્યક્રમ અંત્ગાત બહેનોને પેટ્રોલ પંપ પર, Bus Rapid Transit Service, હોસ્પિટલમાં મોકલે જ છે. આ દીકરીઓને પેન્ટ શાર્ટ પહેરીને કામ કરવામાં વાંદ્યો નથી આવતો. અમદાવાદ શહેરમાં ચાલતાં મોલને માર્કેટ સર્વે કરાવવા માટે બહેનો જોઇએ ત્યારે તેઓ સેવાનો સંપર્ક કરતાં. કોઇક બહેનોએ તો મોલમાં જઇને એક મહિનો કામ કર્યુંઅને પછી છોડી દીદું કેમકે તેમનામાં વાતચીત કરવાની, રજુઆત કરવાની, ગ્રાહકને સારીરીટે સમજાવવાની સોફ્ટ સ્કીલનો અભાવ તેમને વર્તાતો હતો. આથી મોલમાં તેમને કપડાં વાળવાનું, ચંપલ ગોઠવવાનું અને અન્ય વસ્તુઓ ગોઠવવાનું કામ આપતાં. જે તેમને ગમતું ન હતું. આ બધી રજુઆતોને દયાનમાં લઇ સેવાએ બહેનોને રી ટેલ ક્ષેત્રમાં આગળ વધે એ માટે તાલીમો આપી તેમની આવડત વધારવા તાલીમ કાર્યક્રમની Retail Orientation Training Initiative (ROTI) રોટી નામથી શરૂઆત કરી.

## CII and RASCI નો સંપર્ક ૨

નવી પેટીના યુવાન યુવતીઓ માટે કામ કરતું હતું. તેમની સંખ્યા મોટી છે અને તેમના કૌશલ્ય વર્ધનની જરૂરીયાત, રોજગારી મેળવવી અને કુટુંબમાં મદદરૂપ થતું એ તેમના માટે વિચારવાની મુખ્ય બાબત છે. આ કામ શરૂ કરતાં પહેલાં ખાસ એ જોતું પડે કે તાલીમ લીધા પછી તેમને કામ મળવાનો શું સ્કોર્પ છે. યુવા પેટીને કામ કચા કચા કિંદમાં મળી શકે એ જાણતું જરૂરી હતું. આ માટે સેવાએ Confederation Of Indian Industry (CII) નો સંપર્ક કર્યો. કેમકે સેવા ત્યાં સહ્ય છે. તેમણે Retailers Association's Skill Council of India (RASCI) કે જે દેશમાં રીટેલ ના ક્ષેત્રમાં કૌશલ્ય વર્ધનનું કામ કરતી સંસ્થાઓ, વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, સંશોધન કરનાર લોકોને સહયોગ આપનાર પ્રાઇપેટ લીમીટેડ કંપની છે

તેનો સંપર્ક કરાવી આચ્યો. તેમના સર્ટીફિકેટની પેદ્યુ છે અને તેમના વિષયો જાણવા મળશે, તેમની સાથે જોડાણ કરવાથી દેશમાં ચાલતી પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજાનનો લાભ કેન્દ્રને અને તાલીમાર્થીને થાર્ય એમ હતો અને તાલીમની રૂપરેખા અને નિષાંત તાલીમકાર મળી શકે તેવી શક્યતા હતી. આ હેતુથી તેમની સાથે જોડાણ કરવાનું વિચાર્યુ.

### **કાર્યકમની સમજ માટે સંચાલકો સાથે મિટીગ ઃ**

દરેક જીવલા અને અમદાવાદ શહેરના કેન્દ્રોની પસંદગી કર્યા બાદ સંચાલકો સાથે મિટીગનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં રોટી કાર્યકમ કેવીરીતે આગળ લઈ જવો છે તેની વ્યુહ રચના નકકી કરવામાં આવી. ટીમને ગુજરાતી ભાષામાં પ્રેરણને બનાવીને આપવામાં આવ્યું. મિટીગમાં સમજાવવામાં આવ્યું કે દરેક કેન્દ્રપરથી આ કાર્યકમ ચલાવવા કેટલાં લોકોની ટીમ હોવી જોઇશે અને તેમનામાં શું આવડત હોવી જોઇશે એ વિચારી ટીમના નામ નકકી કરીને આવતી મિટીગમાં લઈને આવવા રહ્યું. કાર્યકમ ચલાવવા માટે દરેક કેન્દ્રએ શું કામ કરવાનું રહેશે અને તેનું બજેટ શું હશે એ સમજાવવામાં આવ્યું.

બીજુ મિટીગ એક કાર્યશાળાની જેમ ગોઠવવામાં આવી જેમાં જે તે કેન્દ્રપર સંકળાએલ ટીમના દરેક કાર્યકર્તા અને આગેવાન સભ્યાને કાર્યકમ વિશે અને તેના તબકકાની વિસ્તૃત સમજ આપવામાં આવી. સેવા મેનેજરની સ્કૂલના સંચાલકે તેમની ટીમમાં કામ કરતા બહેનોમાંથી કચા બેન કચા કેન્દ્રો સંભાળશે એ નકકી કરેલ હતું આ બાબતે પણ કેન્દ્રોની ટીમોને જાણકારી આપી. આમ કરવાથી સેવા મેનેજરની સ્કૂલનું કેન્દ્રોના સંચાલક સાથેનું અને કેન્દ્રોના સંચાલકોનું સેવા મેનેજરની સ્કૂલની ટીમ સાથે બરાબર સંકળન ગોઠવાય અને કચાંચા કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અને માસ્ટર ટ્રેનર પસંદગી અને તાલીમાર્થી પસંદગી, તાલીમ ગોઠવી, પ્રોફેશનલ માટે જીવલાના મોલમાં સંકળન કરવું વગેરે બાબતોમાં સાથે રહીને કામ ગોઠવી શકે. આ મિટીગમાં દરેક કેન્દ્રના ખર્ચ સમયસર મળી જાય એ માટે એક તારીખ નકકી કરી કે આ તારીખ સુધી ખર્ચ આવી જ જાય. દર મહિને કેન્દ્રો પર શું કામ ચાલી રહ્યું છે અને એક જીવલાને બીજા જીવલાના પ્રશ્નો અને તેને હલ કરવાની રીત વિશે અરસ પરસ શીખવા મળે એ માટે માસિક મીટીગ કરવાનું વિચાર્યુ જેમાં દરેક પાસેથી તેમના પ્રોગ્રામી જાણકારી મળે.

દરેક કેન્દ્રના ગામોમાં કે શહેરના વિસ્તારોમાં શરૂઆતના વર્કશોપમાં સેવા મેનેજરની સ્કૂલના કાર્યકર્તાને સાથે રહેતાં અને સેવામાં યોજાતી દરેક મિટીગમાં ૨૦-૨૫ મિનીટ આ કાર્યકમ વિશે વાત કરવી જ કરવી એમ નકકી થયા મુજબ એ પણ શરૂ કર્યું અને કાર્યકમનો પ્રચાર બધા જ ગામોમાં થયો. મહેસાણા જીવલામાં સામુદ્દરિક રેડિયો વાલીનો રેડિયો ચાલે છે જેમાં સંભળાવવા ટીમે મળીને રોટીનું ગીત બનાવ્યું અને જે ટીમમાં કામ કરતાં બધાના મંતબ્યો લઈને ફાઇનલ કરવામાં આવ્યું. વિસ્તારો અને ગામોમાં જચારે મીટીગો થાય ત્યારે આ ગીત અચુક વાગવા લાગ્યું.

### **સેન્ટરની પસંદગી ૪**

રોટી કાર્યકમ સેવાના અમદાવાદ શહેરના કચા વિસ્તારમાં અને કચા કચા જીવલામાં લઈ જવાની જરૂરીયાત છે એ બાબતે સેવાના શહેરી યુનિયનના સંચાલક અને અન્ય જીવલાઓમાં લઈ જવા જીવલા મંડળના સંચાલકો અને ટીમોએ સાથે મળી ચર્ચા કરી અને રોટી કાર્યકમનો હેતુ શું છે અને તેમાં કેવીરીતે કામ કરવાનું છે એ સમજાયાં. સેન્ટર પસંદ કરતાં પહેલાં જીવલાઓમાં ઝાન વિઝાન કેન્દ્રો ચાલે છે તેની આજુબાજુમાં કચાં, કેટલાં અંતરે કચા કચા મોલ છે તેની માહિતી એકત્રિત કરી જેથી કચા કચા ઝાન વિઝાન

કેન્દ્રો ને આ કાર્યકમમાં સાંકળવા એ નકકી કરવામાં સરળતા રહે. ત્યારબાદ આ ટીમોએ નકકી કરવાનું હતું, કે આ કાર્યકમ તેઓના કાર્યક્ષેત્રમાં લઈ જવો છે કે કેમ અને કચા કચા ફાન વિઝાન કેન્દ્રો અને શાંતિપથ કેન્દ્રો પસંદ કરવા? આ કાર્યકમ રી ટેલ મેનેજમેન્ટ જેવા નવા વિષયનો છે અને તેમાં તાલીમાર્થીએ ફી ચુકવવી પડે અને તાલીમની પદ્ધતિ અલગ હતી, અલગ પ્રકારના માપદંડોને દચાનમાં રાખીને કામ કરવાનું હતું. કાર્યકમ સેવાના રોજ બરોજના મેનેજરીયલ, સોફ્ટ સ્કીલ અન ટેકનીકલ તાલીમો કરતાં અલગ પ્રકારનો છે. આથી બધા થોડા ચિંતીત જણાતા હતાં અને તેથી આગળ વધવાનો ઉત્સાહ ઓછો જણાતો હતો પણ બધાના મનમાં આ કાર્યકમની અગત્યતા ખુબ જ હતી કારણકે જો આ કામ ગોઠવાય તો નવી પેટીની સભ્ય બહેનોને તેમના મનગમતાં ક્ષેત્રમાં રોજગારી મળવાની સંભાવના હતી. અમદાવાદ શહેરના અને જુલાના સંચાલકોએ આ કામને એક ગુંજેશના રૂપમાં આગળ લઈ જવાનું નકકી કર્યું અને સેવામાં, અમદાવાદ શહેરના ફળિયાઓમાં અને જુલાઓમાં બહેનો સાથે મિટીંગ કે વર્કશોપ ગોઠવાય ત્યાં કાર્યકમની વાત કરવાનું અને પત્રિકા છપાવી, મોબાઇલમાં સંદેશા મોકલી પ્રસાર અને પ્રચાર કરવાનું શરૂ કર્યું. કરણ જુલામાં મોલ બહુ નથી પણ ત્યાં વરસાદની અને તેના લીધે રોજગારીની સમસ્યાને લીધે લોકો સ્થળાંતર કરી મુંબઇ જેવા શહેરમાં સ્થળાંતર કરે છે, ત્યાં જીને મજુરીનું કામ કરે એના કરતાં આવી કોઈ તાલીમ લીધેલી હોયતો મુંબઇના મોલમાં કામ મળી રહે એમ વિચારીને જુલાની પસંદગી કરી. આમ બધાંએ સાથે મળી અમદાવાદ શહેરના ૧૦ અને ૮ જુલાઓમાં ૧૭ એમ કુલ રેફન્ડ્રોની પસંદગી કરી.

## માસ્ટર ટ્રેનરની પસંદગી ૪

તાલીમો કેન્દ્રો પરથી તાલીમ કરવા માટે તાલીમના માસ્ટર ટ્રેનર જે તે કેન્દ્રપર હોવા જરૂરી છે. માસ્ટર ટ્રેનરની પસંદગી કરતી વખતે બધાંએ સાથે મળીને આપણાં સેવાના અનુભવ મુજબ નકકી કર્યું કે દરેક સેન્ટર દીઠ ઓછામાં ઓછા બે માસ્ટર ટ્રેનરસ્તો હોવા જ પડે કેમકે બે બહેનો હોયતો આટલાં લાંબા તાલીમના દિવસોનો ભાર એક જ વ્યક્તિ પર ના આવી જાય અને અચાનક કોઈ કારણોસર કોઈ તાલીમ આપવા ના આવી શકેતો બીજા માસ્ટર ટ્રેનર એ કામ સંભાળી લે. અને આપણે એવા બહેનોને પસંદ કરવા કે જે સેવાની બીજુ પ્રવૃત્તિમાં સંકળાયેલાના હોય કેમકે આ વિષયની તાલીમ દરેક જુલામાં શરૂ થશે પછી આ માસ્ટર ટ્રેનરનોએ સતત આ તાલીમ કરતાં જ રહેણું પડશે અને જો તેઓ બીજુ પ્રવૃત્તિમાં કામ કરતાં હશે તો આ કાર્યકમને ન્યાય નહીં આપી શકે. જુલાની ટીમે એવા બહેનોને પસંદ કર્યા કે જે બહેનો સેવામાં તાલીમો આપતી હોય. કારણકે તેમને એમ હતું કે આપણા તાલીમકાર બહેનો માટે સરળ રહેશે. ખરેખર તાલીમ લીધી અને પછી માસ્ટર ટ્રેનર તરીકે તેમનું રેટીંગ પદ્ધતિથી મુદ્દ્યાંકન કરવામાં આવ્યું ત્યારે આપણા વર્ષોથી તાલીમ આપતાં માસ્ટર ટ્રેનર આ તાલીમ બરાબર ના આપી શક્યા અને તેમને ના પાડવી પડી અને નવા માસ્ટર ટ્રેનર પસંદ કરવાનું કહેવામાં આવ્યું. પસંદ ના થયેલાં બહેનો બાબતે જુલાની ટીમોની નારાજગી સામે આપતી કેમકે સેવાના માસ્ટર ટ્રેનર આપણા માહિતગાર વિષયોમાં એકદમ કુશળ છે, પણ આ તાલીમ એકદમ અલગ પ્રકારની છે જેમાં પેચાણ કરવાની કળા આવડવી જોઈએ. તેમનો દેખાવ, પહેરવેશ અને ઉમર અગત્યાના છે. તાલીમમાં વિચારી શીખવાની હોય પણ આ તાલીમમાં તો પ્રેક્ટીકલી જુદા જુદા પ્રકારના મોલમાં જીને શી ખવાનું અને પછી આવી જ તાલીમ જુલાના ભાઇઓ બહેનો ને આપવાની. નવી બહેનોને પસંદ કરવાનું કામ તો ઉભું જ રહ્યું. આ બધું પચાસવું આપણા માટે સમય માંગી લે એવું હતું. આ રેટીંગ બહારથી આપેલા વિષય નિષ્ણાંતતાલીમકારે કરેણું હતું એટલે બધાને ના પસંદગીનું કારણ મોકે પડે પણ સમજાયું.

## તાલીમકારોની પ્રાથમિક તાલીમ પ

આ તાલીમ આગળ કેવીરીતે લઈ જવી તેની મુજબણ સતત ચાલતી હતી, માસ્ટર ટ્રેનર બનવા માટે લેખિત અને મૌખિક પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ લેતું જરૂરી હતું. વિષય સેવા માટે નવો હતો અને આગળ તાલીમ લઈને જાય એમના માટે રોજગારીનો શું અને કેટલો સ્કોપ હતો એ ખબર ન હતી. CII સાથેઆ બાબતે મિટીના કરી અને ગુજરાતમાં આ કાર્યકમ બીજે કચાં ચાલે છે તેની ચર્ચા કરતાં જાણવા મળ્યું કે દિલ્હીમાં રાસ્કી નામની સંસ્થા છે જેના પોતાના પાર્ટનર ધાણાં મોલ છે, તેઓના સર્ટિફિકેટની પેદ્યું છે તેઓને સાથે જોડાણ કરતાં તેમણે તાલીમ કાર્યકમની રૂપરેખા આપી અને સેન્ટમ લન્નીના સંસ્થામાંથી નિષ્ણાંતને સેવામાં તાલીમ આપવા માટે મોકદ્યાં. આ તાલીમકાર જરા અલગ સ્વભાવના અને કડક હતાં. સેવામાં આપવામાં આવતી તાલીમ કરતાં તેમની તાલીમ આપવાની રીત અલગ હતી. તાલીમાર્થીઓનો તેમની સાથે સુમેળ ન હતો બેસતો. તેઓ રાત્રે ઘરે બેસીને હોમ વર્ક કરવાનું કામ સોંપતા અને બીજા દિવસે રજુઆત કરવાની રહેતી. આ બધું બહું અધર પડતું બહેનોને. સવારથી વહેલાં પોતાના ધરનું કામ પતાવી જીદ્દામાંથી વહેલાં નિકળો અને રાત્રે મોડા પહોંચી ધરનું કામ પતાવી વાંચતું પડે અને એ પણ અંગ્રેજી ભાષામાં અને નવા વિષયમાં . આપણી આંખ ખૂલી ગઈ કે રી ટેલ ક્ષેત્રમાં કામ કરવા માટે લોકોને તૈયાર કરવા હશે તો એક પ્રકારની શિસ્ત કેળવવી જ પડશે. આ નિષ્ણાંત બહેનોને એમના નામથી બોલાવતાં આપણે સેવામાં માનની નામની પાછળ 'બેન' અચુક બોલીએ. આ ભાઈ આપણાં આણંદના અનિતાબેનને અનિતા કહી બોલાવતાં તો અનિતાબેન કહેતાં મારેતો તમારી ઉમરનો દીકરો છે . તો પણ હું તમને અનિતા જ કહીશ એવો વળતો જવાબ આપતાં. આવું બહેનોને જરાં ઓછું ગમતું. વળી તાલીમ દરમ્યાન તાલીમના નકકી થયેલાં સમયનું ચુસ્ત પાતન કરતું , મોબાઇલ બંદ રાખવા, તાલીમ દરમ્યાન વારંવાર ઊભા થઈને બહાર નહી જવાનું જેવા કડક નિયમો અધરાં પડતાં . છેવાટે તાલીમાર્થીઓને સમજાયું કે આપણે સારા માસ્ટર ટ્રેનર બન્યું હશે તો આ રીતે તૈયાર થતું જ રહ્યું. રીટેલની તાલીમ આપવા આપેલાં બીજા તાલીમકાર જેમની સાથે તાલીમાર્થીઓને ફાય્દું અને તેમણે તાલીમને સરળ બનાવીને શીખવાડયું. તાલીમ દરમ્યાન રીટેલ શોપમાં અનુભવ અને અવલોકન કરવા પણ જવાનું હતું.

આ દિવસો દરમ્યાન એક નવો જ અનુભવ થયો અને સમજાયું કે આ દુનિયા આપણી સેવાની દુનિયાથી અલગ જ છે અને એ પણ સમજાયું કે રીટેલ ક્ષેત્રમાં કામ કરતું હોય તેણે આ ક્ષેત્રની પ્રાથમિક તાલીમનો અનુભવ લેવો જ પડે. આ તાલીમ લેવાથી રી ટેલ મેનેજમેન્ટ વિશે આશી પાતળી સમજ આવી. તેમની તાલીમ હિન્દી ભાષામાં હતી. કેટલાંક તાલીમાર્થીને ભાષાકીય રીતે અધર પડયું. તાલીમ આપવાની પદ્ધતિ સેવા મેનેજરની સ્કૂલ કરતાં અલગ પ્રકારની હતી. તેઓ અમદાવાદના સ્થાનિક છે જેથી તેમની સાથેનું જોડાણ બરાબર રહેશે એમ વિચારી રાહત અનુભવી કે નવો રસ્તો મળી ગયો. તેમના દવારા માસ્ટર ટ્રેનરની તાલીમ, મુલ્યાંકન , પ્રેક્ટીસ અને રીફેશમેન્ટ તાલીમો સતત ચાલુ રાખી. તેમણે અત્યાર સુધી ----- માસ્ટર ટ્રેનરને ----- તાલીમો આપી છે. તાલીમકારે અમદાવાદના રી ટેલ સ્ટોર્સ સાથે તાલીમ દરમ્યાન મુલાકાત અને ઓન દા જોબ તાલીમ લેવા માટે જોડાણો કરી આપવાની અને માસ્ટર ટ્રેનરને તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી.

## તાલીમનું માળખું ૬

રી ટેલ મેનેજમેન્ટ વિષય નવો છે માટે આ ક્ષેત્રમાં કામ કરવા માટે અગ્રાઉથી તાલીમ લેવી જરૂરી છે. આ તાલીમ આપવા માટે આપણી સાથે નિષાંતો જોડાયા. એક તાલીમ લીધી પછી બદાંએ સાથે મળીને નકકી કર્યું કે આ તાલીમ બે અઠવાડિયાની રાખવી જોઇએ અને તેમાં કચા કચા અગત્યાન મુદ્દા વણી શકાય. એક અઠવાડિયું કલાસરૂમ અને એક અઠવાડિયું ઓન ધ જોબ તાલીમ આપી શકાય એ રીતે અભ્યાસકમનું માળખું બનાવ્યું છે. કલાસરૂમ તાલીમમાં તાલીમાર્થીઓને રી ટેલના વિષયોની સાથે સાથે ગુમીગા, પ્લેટફોર્મ સ્કીલ, વાતચીત કરવાની કળા, રજુઆત કરવાની કળા, રી ટેલ મેનેજમેન્ટ અને જુદા જુદા પ્રકારના મોલમાં વિઝીટ કરવાની એમ વિચાર્ય. રી ટેલ ક્ષેત્રમાં તાલીમાર્થીએ મોલમાં કામ કરવાનું એટલે જેમ ચોપડી વાંચીને તરવાનું ના શીખી શકાય એના માટે પાણીમાં કુદટું જ રહ્યું એમ મોલ વિશે કલાસરૂમમાં ન ભણી શકાય. એના માટે મોલમાં જઈને અનુભવ લેવો જ પડે. તાલીમના છેલ્લા દિવસે કલાસરૂમમાં બધા તાલીમાર્થી ભેગા મળીને એક મોલ બનાવે તેમાં બધી જ વ્યવસ્થા મોલ જેવી ગોઠવે અને સેવાની કાર્યકર્તા બહેનો ગ્રાહક બનીને ખરીદી કરવા જાય અને મજા ત્યારે આવે જાયારે અમુક બહેનો વિચિત્ર ગ્રાહક બનીને જાય અને અમુક બહેનો કાઉન્ટર પર ઉભેલા બેના/ ભાઈને ગુસ્સો આપાવે, વસ્તુ પાડી દે એવી હરકતો કરે અને જોવે કે કાઉન્ટર પર ઉભેલા ભાઈ/ બહેન કેવું વર્તન કરે છે, તેમને પ્રોડક્ટ વિશે પુરતી સમજ છે કે નહીં. ત્યારબાદ એક ફિડબેક સેશન યોજાય જેમાં ગ્રાહક અને કાઉન્ટર પર ઉભેલા સેસ એક્ઝિક્યુટિવનો અનુભવ કેવો રહ્યો તથા શું બરાબર હતું અને શું નહીં તેની ચર્ચા થાય.

## તાલીમાર્થીની પસંદગી ૭

તાલીમાર્થીની પસંદગી માટે સૌ પ્રથમ દરેક જુલાના દરેક સેન્ટરોના ફળીયાઓમાં ,ગામોમાં તથા કોલેજોમાં કાર્યશાળા યોજવામાં આવી અને તેમાં રી ટેલ ક્ષેત્ર શું છે, તેમાં રોજગારીની કેવી તકો છે અને તાલીમ લેવાની જરૂર કેમ છે, કેટલાં દિવસની તાલીમ હોઇ શકે, તાલીમ ફી, સ્ટીફિકેટ વગેરે બાબતોની ચર્ચા કરવામાંઆવી. તાલીમના બ્રોશર તથા પત્રિકાઓ વહેંચીને વધારેમાર્ફ વધારે લોકો સુધી પહોરયા. જે તાલીમ લેવા ધરછતાં હોય તેમને નામ નોંધાવવાની અને ઇન્ટર વ્યુમાં હાજર રહેવાની તારીખ આપવામાં આવી. નકકી કરેલા દિવસે તાલીમાર્થીની પસંદગી કરી. આ કરતી વખતે તાલીમાર્થીની સામાન્ય માહિતીની સાથે સાથે તેમના ભાષાકીય ઝાન તથા કોમ્પ્યુટરની જાણકારી કેટલી છે, તેમનું ગામ અને જુલાલો છોડી તાલીમ લેવા અને રોજગારી મળેતો કામ કરવા તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરી હતી. ઇન્ટર વ્યુ દરમયાન એ અનુભવ્યું કે, ગ્રામ્યા વિસ્તારમાં રહેતાં તાલીમાર્થીને આ ક્ષેત્રમાં કામ કરવા માટે રી ટેલ ક્ષેત્રના ઝાનની સાથે સાથે પોતાનો દેખાવ, પ્લેટફોર્મ સ્કીલ, વાતચીત કરવાની અને રજુઆત કરવાની કળાની, રીટેલ મેનેજમેન્ટ , પ્લેસમેન્ટ તથા લેઝિટ પરીક્ષા આપવા કોમ્પ્યુટરથી બરાબર જાણકાર હોવા પડે માટે પરીક્ષા જેવા થોડા હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરી તેમને પ્રેક્ટીસ કરાવવી એવું ગોઠવવામાં આવ્યું.

કાર્યકમની શરૂઆતમાં મોલની વિઝીટોમાં મુલાકાતો કરી એ દરમયાન સમજાયું કે રીટેલ ક્ષેત્રમાં કામ કરવા માટે ઉમેદવારની લાયકાત અને જરૂરી દસ્તાવેજો આ મુજબ હોવા જોઇએ. જો આ મુજબ ના હોયતો પેચાણ કાઉન્ટર પર જોબ ના મળે.

- ઓછામાં ઓછા ૧૦ ઘોરણ ભણેલાં હોવા જોઇએ.

- એ કે એ પાસ ને ઓન દા જોબ તાલીમ મળી જાય પણ કચાંય જોબ પર ના રાખે.
- તેમનું ઓળખપત્ર હોવું જરૂરી છે.
- PAN Cardહોવું જોઈએ.
- ઉમરનો પુરાવો હોવો જોઈએ.

આ વાતને દ્યાનમાં રાખીને પણ તાલીમાર્થીની પરસંદગીમાં અને તેમના દસ્તાવેજો પરસંદ કરવામાં થોડા કસ્ક રહેવું પડે, જે પાછળથી તેમના જ ફાયદામાં રહે. કાર્યશાળા અને ઇન્ટર વ્યુ દરમયાન એ જાણવા મળ્યું કે, ફેક્ટરી, કારખાના કે જોબ વર્ક કરવા જતાં હોય, કોલેજમાં ભણવા જતાં હોય એ ભાઈઓ બહેનોને તાલીમ લેવાં આવતું છે. તેઓ તાલીમના સમય પ્રમાણે આવવા ફી નથી થઈ શકતાં આથી માળખામાં ફેરફાર લાવવા મનન અને ચિંતન કરીએ છીએ.

### **રી ટેલ મેનેજમેન્ટની તાલીમો એ**

બધું ગ્રાઉન્ડ વર્ક કર્યા પછી સતત માસ્ટર ટ્રેનરને તૈયાર કરવા અને કાર્યકમની જાણકારી માટે એક અલગ ટીમ રાખવામાં આવી અને આ બંને કામ સાથે સાથે ચાલતાં જાય. નવા તાલીમકાર સાથે જુલાઇ માસમાં વિષયની સમજ માટે પ્રણ દિવસની પ્રાથમિક તાલીમ ગોઠવી જેમાં જુલામાંથી અને સેવા મેનેજરની સ્કૂલના તાલીમ કોઓડિનેટરોને સાંકળ્યા. તાલીમ દરમયાન રીટેલ શોપમાં અનુભવ અને અપલોકન કરવા પણ જવાનું હતું. આ દિવસો દરમયાન એક નવો જ અનુભવ થયો અને સમજાયું કે આ દુનિયા આપણી સેવાની દુનિયાથી અલગ જ છે અને એ પણ સમજાયું કે રીટેલ ક્ષેત્રમાં કામ કરવું હોય તેણે આ ક્ષેત્રની પ્રાથમિક તાલીમનો અનુભવ લેવો જ પડે.

### **માસ્ટર ટ્રેનરની તાલીમ અને પ્રેક્ટીસ તાલીમો**

આ તાલીમ જુલાના અને અમદાવાદ શહેરના કેન્દ્રો પર કરવા માટે માસ્ટર ટ્રેનરને એક વખત વિષયની તાલીમ આપી અને તેમનો પોતાનો આત્મ વિશ્વાસ આપવો જરૂરી હતો અને તેઓ વિષયને બરાબર જ્યાય આપે એ જાણવું જરૂરી હતું. વિષય નવો હતો અને વારંવાર વાંચવો પડે, સમજવો પડે, ચિંતન અને મનન કરવું પડે ત્યારે બરાબર આવડે. આ માટે વારંવાર તેમની તાલીમની પ્રેક્ટીસ તાલીમો ગોઠવી તેમને તાલીમકાર તરીકે તૈયાર કરવામાં આવ્યા. જેમ જેમ માસ્ટર ટ્રેનર તાલીમ લેતાં ગયા તેમ તેમ તેમની પ્રેક્ટીસની તાલીમ ગોઠવાતી ગઈ.

તાલીમની પ્રેક્ટીસમાં માસ્ટર ટ્રેનરના તાલીમ આપવાની, વિષયવાર મુશ્કેલી જોતાં અલગ અલગ રીતે પ્રેક્ટીસ અને મુલ્યાંકન ગોઠવતાં ગયા.

પહેલાં તેમને વિષયવાર તાલીમકાર પાસે તાલીમ આપાવી તેમાંતેમને સમજવામાં અદાર પડતું હતું તેથી આ જ તાલીમ તેમને ફરીથી આપી. તાલીમના છેલ્લા દિવસો કલાસરૂમમાં બધા માસ્ટર ટ્રેનર ભેગા મળીને રી ટેલની તાલીમમાં શીખ્યાએ દરેક પાસાને દ્યાનમાં રાખીને એક મોલ બનાવે તેમાં બધી જ વ્યવસ્થા મોલ જેવી ગોઠવે અને સેવાની કાર્યકર્તા બહેનો ગ્રાહક બનીને ખરીદી કરવા જાય અને મજા ત્યારે આવે જ્યારે અમુક બહેનો વિચિત્ર ગ્રાહક બનીને જાય અને અમુક બહેનો કાઉન્ટર પર ઉભેલા બેન કેવું વર્તન કરે છે, તેમને પ્રોડક્ટ વિશે પુરતી સમજ છે કે નહીં. ત્યારબાદ એક ફિડબેક સેશન યોજાય જેમાં ગ્રાહક અને કાઉન્ટર પર ઉભેલા સેસ

એકગીકયુટીવનો અનુભવ કેવો રહ્યો તથા શું બરાબર હતું અને શું નહી તેની ચર્ચા થાય. આમ કરતાં બહેનો બરાબર ઘડાઇ ગયા. જેમાંથી તેમને શીખવા મળ્યું. ત્યારબાદ તેઓ તેમની પસંદગીનો વિષય તૈયાર કરીને તાલીમ આપે એવું ગોઠવાયું. તેમને બધાં ને તાલીમ આપવા માટ એક કલાક આપીએ તો કોઈનું સત્ર ૧૦-૧૫ મિનીટમાં જ પુરુ થઈ જતું અને કોઈને બે કલાક લાગતાં. આથી લાગ્યું કે તેમને હજુ વધારે શીખવાની જરૂર છે. માસ્ટર ટ્રેનરને ધરે તૈયારી કરવાનું કહ્યું અને પહેલાં અઠવાડિયામાં એક દિવસ આવી પહેલાં દિવસની તાલીમ આપવી અને બીજા અઠવાડિયે બીજા દિવસની તાલીમ આપે અને એક દિવસે પ્રણા જીવલાની બહેનો જોડાય આમ કુલ પ્રણા એક દિવસમાં એક દિવસની પ્રેક્ટીસ પૂરી થાય. માસ્ટર ટ્રેનર ધરેથી તૈયારી કરીને ન હતાં આવી સકતાં એટલે પછીના અઠવાડિએ એવું ગોઠવ્યું કે અડધો દિવસ તેઓ બધાં સાથે મળીને પ્રેક્ટીસ કરે અને બપોર પછી તાલીમ આપે. તાલીમ દરમયાન પહેલી વખત બહારના તાલીમકારે મુલ્યાંકન કર્યું અને જે બહેનો બીલકુલ ન હતાં ચાલે એવા તેમને ફરીથી આવવા માટે ના કહી. મુલ્યાંકન કરવા માટે દરેક દરેક તાલીમમાં સેવા મેનેજરની સ્કૂલના એક માસ્ટર ટ્રેનર જોડાય અને દરેક માસ્ટર ટ્રેનર બીજા માસ્ટર ટ્રેનરનું મુલ્યાંકન કરે અને તેમને ૧, ૨, ૩, ૪ કે ૫ ( ૧ એટલે વધારે સારા અને ૫ એટલે એકદમ નબળાં ) નંબર આપે. આમ તેઓ બધાં એકબીજાનું અરસપરસ મુલ્યાંકન કરે. આમ કરવાથી જાણવા મળે કે કચા વિષય પર હજુ વધારે તૈયાર થવાની જરૂર છે. જ્યાં સુધી માસ્ટર ટ્રેનર બરાબર તૈયારના થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રાખીશું એમ પિંચાર્ય,

### જીવલા અને અમદાવાદ શહેરના સેન્ટરો પર તાલીમ ૮

- સૌ પ્રથમ સાબરકાંડા જીવલાના તાલીમાર્થી તાલીમ લેવા માટે તૈયાર થયા. પહેલી બેચ હોઇ તાલીમ સેવા મેનેજરની સ્કૂલના તાલીમ હોલમાં ગોઠવી હતી. તાલીમમાં પહેલાં દિવસે ૧૫ તાલીમાર્થી આવ્યા અને બે દિવસ પછી તેઓ પરત જતાં રહ્યા. પછીના દિવસોમાં ૧૩ તાલીમાર્થીઓ બધા દિવસ માટે આવ્યા. તાલીમ દરમયાન જોયું કે તેઓ પહેલાં દિવસે બહુ શરમાતા હતાં અને તેમનો અવાજ નિકળતો ન હતો. બીજા દિવસે વાતચીત કરવાની કળા અને રજુઆત કરવાની કળાની તાલીમમાં તેમને બોલ્યું પડે એવી ઘણી એકસાઇસ કરવાની હતી. તેઓ બીજા દિવસથી બોલતાં થયા. સાત દિવસ દરમયાન ઘણું પરિવર્તન તેમનામાં જોવા મળ્યું.
- તાલીમ દરમયાન હાઇપર સીટીની પ્રેક્ટીકલ તાલીમ દરમયાન સીફુટમાં કામ કરવામાં તાલીમાર્થીને અધ્યું લાગ્યું. તેમને આટલા કલાક ઊભા રહીને કામ કરવાની પ્રેક્ટીસ ન હોઇ બહું તકલીફ થતી. તેઓ જે દિવસે મોલમાં કામ કરવા ન જાય એ દિવસે સેવા મેનેજરની સ્કૂલમાં કે મોલના જવાબદાર વ્યક્તિને તેની જાણ ન હતાં કરતાં. જેના માટે પાછળથી આપણને મોલ તરફથી સાંભળ્યું પડતું. તાલીમાર્થી સાથે વાત કરતાં જાણ્યું કે, તેમને બધાને એક સરખા સમરે કામ કરવા જતું હતું અને ૨૪ પણ સાથે જ જોઇતી હતી. છોકરાઓને રાત્રે મોડા સુધી કામ કરવું ગમતું ન હતું. જે કોઇ તાલીમાર્થી ભાઇ કે બેન સારુ કામ કરે તેને હાઇપર સીટીમાંથી નોકરી કરવાની તક આપીશું એમ બીજા તાલીમાર્થીની સામે કહેતાં, જેથી અન્ય ભાઇ બહેનને થતું કે કેમ અમે સારુ કામ નથી કરતાં? બીજા જ દિવસથી તેઓનો મુડ બદલાઈ જતો કે કામ પર આવવાનું બંધ કરી દેતાં.
- અમૃક તાલીમાર્થીના કિસ્સામાં એવું ય બન્યું કે તેઓ જ્યાં રહેતાં હતાં એની આજુબાજુમાં રહેતા પડોશી જ્યાં કામે જતાં ત્યાં કામ કરવાનું આપણા તાલીમાર્થી ગોઠવતાં. એ વખતે સેવામાં હિંતા થતી કે આ નાના અને નવા સવા છોકરાઓ પાસે કોઇક એવું કામ ન કરાવતાં હોય જે પાછળથી

તેમના માટે ચિંતાનો વિષય કે ભારજનક પુરવાર થાય અને તેમને વળતર કેટલું ચુકપે છે કામ અને કામના સંદર્ભમાં એ પણ જોતું પડે. નાના અને શહેરમાં નવા છોકરાઓને આ વાત ના સમજાય.

- ત્યાર બાદ અમદાવાદ અને ગાંધીનગર જીવલાની તાલીમો ગોઠવાઈ, અમદાવાદના ચાર શાંતિપથ કેન્દ્રો પર તાલીમો ગોઠવાઈ. હાલમાં મહેસાણા, આણંદ અને બોડેલી જીવલામાં જ્ઞાન વિઝાન કેન્દ્રો પર માર્સ્ટર ટ્રેનર તાલીમ આપે છે.
- તાલીમ ગોઠવા માટે બધા સેન્ટર પર ખુરશી ટેબલ પર બેસાડવાની વ્યવસ્થા નથી એ ગોઠવા કરવી અધરી છે, કાર્યકમમાં એની જોગાવાઈ નથી. આથી જીવલામાં તાલીમ ગોઠવવામાં અગત્ત પડે છે.

## તાલીમ મોડયુલ

રાસ્કીની તાલીમમાં રી ટેલ મેનેજમેન્ટના વિષયનું તાલીમ મટીરીયલ આપ્યું હતું. તાલીમ આપતી વખતે સામાન્ય સમજ મળી હતી. આ મટીરીયલ પર તેમનો કોપીરાઇટ હતો જેથી સીધે સીધી તેની વિગતો વાપરી શકાય જ નહીં. આ તાલીમ લઇ સેવાએ રૂપી ૩૬,૦૦૦ જેટલાં લોકોને તૈયાર કરવાના છે અને સેવાએ ઓછામાં ઓછા ૮ ધોરણ અભ્યાસ કરેલાં ગ્રામીણ અને શહેરી યુવા પેટીને દચાનમાં રાખીને મોડયુલ તૈયાર કરતું પડે એમ હતું. સેવા મેનેજરની સ્કુલની ટીમે જાતે મોડયુલ બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ મોડયુલ બનાવવા માટે એક તાલીમ નિષ્ણાંત બેનને બોલાવ્યા. તેમના બનાવેલા તાલીમ મોડયુલની રીત અલગ હતી. તેઓએ થોડા ઉચ્ચ લેવલના માર્સ્ટર ટ્રેનર્સ અને તાલીમાર્થીને દચાનમાં રાખી મોડયુલ બનાયું હતું. તેમને અમે સતત કહેતાં કે તમે ગ્રાસરુના લોકોને સમજાય તેવું મોડયુલ બનાવજો પણ આ તેમને સમજાતું નહીંઅને તેઓ દલીલો કરતાં કે આટલું બધુંમાર્સ્ટર ટ્રેનરને કહેવાનું ના હોય તેમને જાતે જ પ્રવૃત્તિ કરતાં આવડતું જોઈએ. આપણે સેવા મેનેજરની સ્કુલના મોડયુલમાંબાના સુચના આપતાં હોઇએ છીએ જેમકે, હવે તમે તાલીમાર્થીને કહોકે તમારામાંથી ૩ તાલીમાર્થી પ્રવૃત્તિ કરવા માટે સ્વેરછાએ આગળ આવે અને હવે તમે તેમને સમજાવો કે તમારામાંથી બે ગ્રાહક હશે અને એક વ્યક્તિ પેચાણ કાઉન્ટર પર ઉભા રહેશેઅને તમારે હવે રોલ પ્લે કરવાનો છે.

રાસ્કીની તાલીમ દરમયાન મૌખિક પરીક્ષા લેવાં બદારથી જે નિષ્ણાંત આવ્યા હતાં તેમણે રાસ્કીનું અને સેવા મેનેજરની સ્કૂલે બનાવેલું મોડયુલ જોતું અને સુચન કર્યું કે આટલાં બધા વિષયો ભણાવવાની જરૂર નથી રીટેલ ના પેચાણ કાઉન્ટર પર કામ કરવા માટે અમુક પાચાનું જ્ઞાન હોય તો ચાલે. આ તાલીમ આપવાની જવાબદારી લેવાનું તેમણે સ્વીકાર્ય. તેમણે આ માટે પ્રેરણેશન તૈયાર કર્યું અને અમદાવાદના જુદા જુદા મોલમાંટીમને કર્યાં કર્યાં મોકલી શકાય એ ગોઠવણ કરી.

## ઓન દા જોબ તાલીમ

આ તાલીમ માટે કાર્યકમની શરૂઆતમાં એક બે મોલમાં વાત કરી હતી. ત્યારબાદ તાલીમની પહેલી બેચ તૈયાર થઈ ત્યારે અમદાવાદમાં હાઇપર સીટી અને સેન્ટ્રલ મોલમાં વાત કરી હતી અને હાઇપર સીટીના એચ.આર. મેનેજર સાથે રૂબરૂ જઈને મિટીંગ કરી હતી અને તેમને જણાયું હતું કે અમારી બેચ ગ્રામીણ

વિસ્તારની પણ હશે. તેની સાથે તેમને વાંધો ન હતો. તેઓએ તાલીમાર્થી માટે સાત દિવસ, દસ દિવસ અને એક મહિનો ઓન દ જોબ તાલીમ આપવાની તૈયારી બતાવી અને એમ પણ કહ્યું કે તમારી બેચમાંથી જે તાલીમાર્થી એક મહિનો તાલીમ લેશે અને એ અમને સારા લાગશે તો તેમને અમે કામપર રાખી લઈશું. તેઓ પહેલી બેચને મળવા સેવામાં આવ્યા હતાં. અત્યાર સુધી હાઇપર સીટીમાં પાંચ બેચમાં ૨૨ તાલીમાર્થી અને સેન્ટ્રલ મોલમાં બે બેચમાં ૯ તાલીમાર્થી ઓન દ જોબ તાલીમ લીધી છે. આ તાલીમ દરમાન તાલીમાર્થીઓ સાથે ખાટાં મીઠા અનુભવો રહ્યા. જેમકે ,

- તાલીમાર્થી બહેનો ભાઈઓને મોલના નિયમો પ્રમાણે સમયસર પહોંચતું અધર પડતું હતું.
- તેઓ રજા રાખવી હોયતો પોતાની મરજુથી રજા રાખતાં અને છેવટે મોલમાંથી ફોન આવતો ત્યારે ખબર પડતી કે આજે જે તે વ્યક્તિ તાલીમ માટે ગયા નથી.
- મોલમાં છોકરીઓ અને છોકરાંઓ માટે અલગ સમય હોય તેઓ સાંજે ૭-૮ વાગ્યા બાદ છોકરીઓને રાખતાં નથી એટલે કે તેમની ડયુટી સવારે વહેલાંશરૂ થાય અને સાંજે ઝડપથી પુરી થાય. છોકરાંઓને બપોરે જવાનું અને રાએ મોલ બંધ થાય ત્યાં સુધી રહેવાનું. એક જ જુલાના ભાઈઓ બહેનો હોય ત્યારે તેમને બધાંને સાથે જ કામે જવું હોય અને સાથે જ રજા રાખવી હોય. અમની ઘરછા પ્રમાણે ના થાય એટલે જવાનું બંધ કરી દે અને પુછીએ ત્યારે ખબર પડે કે તેમને શું પ્રશ્ન છે. આમ થાય એટલે મોલનું કામકાજ પણ બાડે.
- હાઇપર સીટીને જે બહેન કે ભાઈ બરાબર લાગે તેને તરત જ કહી દેતાં કે તમારી તાલીમ પુરી થાય કે તરત જ તમને જોબ પર લઈ લઈશું. આ વાત બીજા ભાઈઓન સાંભળતાં તો તેમને દુઃખ થયું કે અમને કેમ નહીં? પછી તેઓના કામ કરવા પર અસર થતી અને પછી તેઓ અચાનક મોલમાં જવાનું બંધ કરી દેતાં. તેમને ફરીથી મનાવી સમજાવીને મોકલવા પડતાં.
- તાલીમ દરમાન એક દુખદ અનુભવ સાબરકાંઠાના તાલીમાર્થી નરેન્દ્રભાઈનો રહ્યો. તેઓ આર્ટસ ગ્રેજ્યુએટ છે. કલાસરૂમ તાલીમમાં આખી બેચમાં તેઓ સૌથી વધારે હોશિયાર હતા. તેઓ એક મહિનો ઓન દ જોબ તાલીમમાંગવા હતાં. તેમનું ત્યાં પણ પરફોર્મન્સ સારૂ હતું . હાઇપર સીટીમાં તેઓ પેચાણના કાઉન્ટર પર હતાં. તેમનું કામ જોઈને તેમને કેશીયર તરીકે કામ પર રાખવાની વાત કરી અને રૂ.૧૦,૦૦૦/- મહેનતાણાંની ઓફર આપી. પહેલાં તો આ ભાઈને એ પ્રશ્ન થયો કે તેઓ ઊભા ઊભા કામ કરતાં બીમાર થઈ ગયા અને જવાનું બંધ કરી દીધું. આટલી સારી ઓફર મળી હતી અને તેઓ દુર્લક્ષ રાખતાં હતાં, તેમને આ ઓફરની અગત્યાતા સમજાવવા ઓફિસમાં બોલાવી તેમની સાથે વાત કરી. ત્યારે તેઓ ના જ કહેતાં હતાં હાઇપર સીટીમાં જવાની, વાત વાતમાં ખબર પડી કે તેમને પરોઢા પેક કરવાની જોબ મળી છે અને એ કામ બેઠાં બેઠાં થઈ શકે છે એટલે ત્યાં જ જશો. તેમને સમજાવું કે આટલાં સારા મહેનતાણાંનું કામ કચાંચના મળે તમારે હાઇપર સીટીમાં જવા માટે વિચારતું જોઈએ. તેઓએ કહ્યું કે હું વિચારીને ફોન કરી દઈશ. તેઓએ ફોન પણ ન કર્યો અને મળવા પણ ના ગયાં. ચાર દિવસ પછી મળવા ગયા ત્યારે ખબર પડી કે એ જગ્યા પર કોઈ બીજાને કામે રાખી દીધા છે. તેમને મોડા આવવાનું કારણ પુછતાં તેમણે કહ્યું કે મારે કેશીયર તરીકે કામતો કરવું જ હતું પણ મારા આધારકાર્ડ અને પાનકાર્ડ કરાવવા ગયો હતો. આમ સમયસર વાત ના કરતાં કે મળવા ન જતાં તેમણે નોકરી ગુમાવી.
- અમદાવાદ શહેરના એક બેનને હાઇપરસીટીમાં કામ કરતાંત્યાં કામ કરતાંએક ભાઈ સાથે આણબનાવ બનતાં વાત બહું આગળ વધી ગઈ અને લાંબી ઇંકવાયરી ચાલી. આ બેનનું પરફોર્મન્સ સારૂ હતું પણ તેઓ પણ મોલમાં આગળ વધી શક્યા નાલી.

- એક બેન હાઇપર સીટીમાં તાલીમ લેતાં લેતાં મોલના બીજા કાર્યકર્તા સાથે મિત્રતા કરીને એક બાંડમાં કામ કરવા જોડાઈ ગયાં, મોલમાં જવાનું થયું સેવા તરફથી પણ જોબ મળી એટલે મારી જાતે જ મળી છે એમ કહેવા લાગ્યા.
- એક જુલાની બહેનો હાઇપર સીટીના બહેનને ધેરી વળી અને કહેવા લાગ્યી કે અમને તો સેવાએ કહ્યું છે કે અમને તો આહી જોબ મળી જ જશે. તમારે અમને જોબ આપવી જ પડશે. આમ તેઓ આગાઉથી અંદર અંદર નકકી કરીને કહેતાં હતાં.

### તાલીમકારોની પ્રાથમિક તાલીમ

આ તાલીમ આગાઉ કેવીરીતે લઈ જવી તેની મુજવણ સતત ચાલતી હતી, માસ્ટર ટ્રેનર બનવા માટે લેખિત અને મૌખિક પરીક્ષામાં પાસ થયાનું સર્ટીફિકેટ લેવું જરૂરી હતું. તાલીમ આપવા આપેલ રાસ્કી સંસ્થાના તાલીમકાર જરા અલગ સ્વભાવના અને કડક હતાં. સેવામાં આપવામાં આવતી તાલીમ કરતાં તેમની તાલીમ આપવાની રીત અલગ હતી. તાલીમાર્થીઓનો તેમની સાથે સુભેળ ન હતો બેસતો. તેઓ રાત્રે ઘરે બેસીને હોમ વર્ક કરવાનું કામ સૌંપત્તા અને બીજા દિવસો રજુઆત કરવાની રહેતી. આ બદ્યુંબહું અધ્યક્ષ પડતું બહેનોને. છેવટે તાલીમાર્થીઓને સમજાયું કે આપણે સારા માસ્ટર ટ્રેનર બનવું હશે તો આ રીતે તૈયાર થાવું જ રહ્યું.

તેમની મૌખિક પરીક્ષા ગોઠવાઈ તેમાં બહારના સલાહકાર/ ટ્રેનર આવવાના હતાં. તેમનો ૮ વર્ષનો રીટેલ ક્ષેત્રમાં અનુભવ હતો. તેમણે રી ટેલ વિષયની તાલીમ આપવામાં સેવાને મદદ કરવાની તૈયારી બતાવી. જુલાઈ માસમાં ત્રણ દિવસની તાલીમ ગોઠવી તેમની સાથે પહેલી તાલીમ ગોઠવાઈ તેમાં ૨૧ માસ્ટર ટ્રેનર અને સેવા મેનેજરની સ્કૂલની ટીમે ભાગ લીધો. જેમની સાથે તાલીમાર્થીઓને ફાય્દું અને તેમણે તાલીમને સરળ બનાવીને શીખવાડયું. તાલીમ દરમયાન રીટેલ શોપમાં અનુભવ અને અવલોકન કરવા પણ જવાનું હતું.

આ દિવસો દરમયાન એક નવો જ અનુભવ થયો અને સમજાયું કે આ દુનિયા આપણી સેવાની દુનિયાથી અલગ જ છે અને એ પણ સમજાયું કે રીટેલ ક્ષેત્રમાં કામ કરતું હોય તેણે આ ક્ષેત્રની પ્રાથમિક તાલીમનો અનુભવ લેવો જ પડે. આ તાલીમ લેવાથી રી ટેલ મેનેજમેન્ટ વિશે આછી પાતળી સમજ આવી. તેમની તાલીમ હિન્દી ભાષામાં હતી. કેટલાંક તાલીમાર્થીને ભાષાકીય રીતે અધ્યક્ષ પડયું. તાલીમ આપવાની પદ્ધતિ સેવા મેનેજરની સ્કૂલ કરતાં અલગ પ્રકારની હતી. તેઓ અમદાવાદના સ્થાનિક છે જેથી તેમની સાથેનું જોડાણ બારાબર રહેશે એમ વિચારી રાહત અનુભવી કે નવો રસ્તો મળી ગયો. તેમના દવારા માસ્ટર ટ્રેનરની તાલીમ, મુલ્યાંકન , પ્રેક્ટીસ અને રીફેશમેન્ટ તાલીમો સતત ચાલુ રાખી. તેમણે અત્યાર સુધી ----- માસ્ટર ટ્રેનરને ----- તાલીમો આપી છે. તાલીમકારે અમદાવાદના રી ટેલ સ્ટોર્સ સાથે તાલીમ દરમયાન મુલાકાત અને ઓન ધ જોબ તાલીમ લેવા માટે જોડાણો કરી આપવાની અને માસ્ટર ટ્રેનરને તૈયાર કરવાની જવાબદારી સ્વીકારી.

### જોડાણો

#### રાસ્કી સંસ્થા સાથે જોડાણ

સેવા માટે આ વિષય નવો હતો, કેવીરીતે તાલીમ આપવી, કોણ તાલીમ આપશે એ વિચારવાનું હતું. સેવાએ CII સાથે વાત કરી , કેમકે સેવા ત્યાં સભ્ય છે. તેમણે RASCI નો સંપર્ક કરાવી આપ્યો તેમના સર્ટીફિકેટની પેટ્યુ છે અને તેમના વિષયો જાણવા મળશે એ હેતુથી તેમની સાથે જોડાણ કરવા વિચાર્યુ. તેમની સાથે

જોડાણ કરવાથી દેશમાં ચાલતી પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજાનનો લાભ કેન્દ્રને અને તાલીમાર્થીને થાય એમ હતો. તેમની સાથે જોડાણ કરવાનું પડકારણ હતું. રાસ્કી સંસ્થા પ્રોફેશનલ સંસ્થા છે અને તેમને સેવા વિશે, જીબા એસોરીએશન વિશે અને અન્ય ભર્જિની સંસ્થાઓ વિશેની માહિતી આપવાની હતી. જે એકદમ કાયદાકીય કાગળો તૈયાર કરવાની બાબત હતી, જેમાં નોટરી કરાવવી પડે અને અંગ્રેજી ભાષામાં લખાણ હોવું પડે. આ પ્રક્રિયા એકદમ લાંબી હતી. આવી માહિતી કોઈ કંપનીએ આપવાની હોય તો તેમના માટે આ વાત સરળ હોત પણ અસંગઠિત વર્ગના બહેનોની સંસ્થાએ હંમેશા બહેનોના પ્રજ્ઞનોમાં કાયદા વિશે સતત સંઘર્ષો કર્યા છે, આ બધા પ્રજ્ઞનોની સાથે બધા જરૂરી લખાણો એક વટવૃક્ષની જેમ ફેલાએલી સેવાની જુદી જુદી ભર્જિની સંસ્થાઓ પાસેથી માહિતી લઇને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાના હતાં અને નોટરી કરાવીને મોકલવાના હતાં. આ બધું ભેગુ કરવામાં ઘણો સમય લાગ્યો.

તાલીમ કલાસરૂમની સુવિદા અને એ રૂમ કઈ સાઇઝનો છે એ માહિતી મેળવવામાં પણ સમય લાગ્યો. આ માહિતી ભેગી કરતી વખતે એટલું શીખ્યા કે આ માહિતી કયાંક એક જગતાએ ભેગી કરેલી હોવી જ જોઈએ. તેઓ તાલીમ કલાસરૂમનું ઓડિટ કરે છે, જેમાં એક સેન્ટરની ઓડિટફી રૂ. ૨૦૦૦ છે. સેવા તેમની પાર્ટનર બને તો તેઓ પાંચ સેન્ટરનું ઓડિટ ફી કરી આપશે. સેવાએ બધા કેન્દ્રની ફી ભરી અને જરૂરી તમામ માહિતી આપી દીધી. આ આડિટ થાય પછી રાસ્કી તરફથી તાલીમના ટાર્ગેટ મળશે. રાસ્કીએ તાલીમાર્થી ના ડેટા અને કેન્દ્રની માહિતી માટે એક સોફ્ટવેર બનાવ્યું છે, સેન્ટર ઓડિટ પછી સેવાને દરેક સેન્ટર માટે log in Id. અને password આપશે.

રાસ્કીની તાલીમ ગુજરાતી કે હિન્દી ભાષામાં હોવાને બદલે કફત અંગ્રેજી ભાષામાં હતી, તાલીમનું સાહિત્ય અંગ્રેજી ભાષામાં હતું. તાલીમ આપવાની પદ્ધતિ એકદમ અલગ હતી. જેમ ઉર્ય કક્ષાની તાલીમમાં તાલીમાર્થીએ જાતે ભણવાનું હોય અને બીજા દિવસે શું સમજયા તેની રજુઆત કરવાની હતી, જે ના સમજાય એ પુછી શકાય, હવે અંગ્રેજી વાંચવામાં જ તકલીફ પડતી હોયતો બાકીની બીજી વાત કયાંથી સમજાય. અંગ્રેજી વાંચી શકે એમનો આત્મ વિશ્વાસ ડાંગો જોવા મળ્યો. આ તાલીમ લઇને પરીક્ષા આપવાની હતી બહેનોએ અને એ પણ ઓન લાઇન. એક તો વાત એવી પણ હતી કે બહેનોએ અભ્યાસ દરમાન પરીક્ષા આપી હશે અને આટલા વરસો પછી ફરીથી પરીક્ષા આપવાની જે તેમના માટે મોટી ચિંતાનો વિષય હતો. સૌથી મોટા માસ્ટર ટ્રેનર ૫૦ વરસના અને સૌથી નાના ૨૦ વરસના બહેન હતાં. એક કલાકમાં દ્રા તર્કસંગત સવાલોના જવાબો આપવાના, કોમ્પ્યુટરમાં પરીક્ષા કરી જોઈ ન હતી. આજુ બાજુના બહેનો ના સવાલોનો કમ અલગ હોય જેથી એકબીજાની મદદ લેવાનું તો બીલકુલ શક્ય જ ન હતું. તાલીમ લેવા આવ્યા ત્યારે મનમાં એમ હતું કે હિન્દીમાં તાલીમ હશે અને તાલીમનું સાહિત્ય અંગ્રેજી ભાષામાં જોઈને નારીપાસ થઈ ગયા તાલીમના કલાકો પણ વધારે હતાં સવારે રૂ.૩૦ થી સાંજે રૂ.૩૦ અને એમાંચ જીબા આવવાનું, રાત્રે ઘરે કચારે પહોંચવાનું અને કચારે વાંચવાનું? આ પરીક્ષા પછી મૌખિક પરીક્ષા (Viva) હતી જે આપવાનું બધા માટે સરળ હતું અને કોઈના ચહેરા પર ચિંતા ન હતી. રોલ પ્લેની પદ્ધતિથી પણ પરીક્ષા લેવામાં આવી, આ રીત સરળ હતી પણ જો વિષયને બરાબર સમજાય હોવ તો. રી ટેલના વિષયો જાતે ઘરે જઈને સમજવા અધરા હતાં માટે તેમાં બહેનોને મુશ્કેલી પડી.

## નવા તાલીમકાર

તાલીમકારોની તાલીમ દરમાન તેમની મૌખિક પરીક્ષા ગોઠવાઈ તેમાં મૌખિક પરીક્ષા લેવા બહારના સલાહકાર/ ટ્રેનર આવ્યા હતાં. જેમનો રીટેલ ક્લેન્ટમાં ૮ વર્ષનો અનુભવ હતો. તેમની સાથે વિષય બાબતે

ચર્ચા થતાં તેમણે રી ટેલ વિષયની તાલીમ આપવામાં સેવાને મદદ કરવાની તૈયારી બતાવી. જુલાઈ માસમાં પ્રણા દિવસની તાલીમ ગોઠવી તેમની સાથે પહેલી તાલીમ ગોઠવાઈ તેમાં ૨૧ માસ્ટર ટ્રેનર અને સેવા મેનેજરની સ્કૂલની ટીમે ભાગ લીધો હતો. તેમણે તાલીમ દરમયાન જુદા જુદા પ્રકારના મોલ અને બાંડના સ્ટોર્સમાં પિંગીટ ગોઠવી રીટેલ ક્ષેત્રનું પાચાનું ઝાન આપ્યું હતું.

## મોલ સાથે જોડાણો

કાર્યકમની શરૂઆતમાં એક બે મોલમાં વાત કરી હતી. ત્યારબાદ તાલીમની પહેલી બેચ તૈયાર થઈ ત્યારે બહારના તાલીમકારની સાથે રહી અમદાવાદમાં હાઇપર સીટી અને સેન્ટ્રલ મોલમાં વાત કરી હતી અને હાઇપર સીટીના એચ.આર. મેનેજર સાથે રૂબરૂ જઘને મિટીંગ કરી હતી. આ જોડાણો સિવાય જુલાઓમાં તાલીમ ગોઠવાય ત્યારે તાલીમાર્થીઓને જુલામાં જ મોલમાં ઓન દા જોબ તાલીમ મળો એ માટે સેવા મેનેજરની સ્કૂલની ટીમના જેતે કેન્દ્રના ઇન્યાર્જ જુલામાં જઘને જુલાટીમ સાથે રહીને બીગ બજાર, ડી માર્ટ, હાઇપર સીટી, આધાર મોલ સાથે સંકલન કર્યું અને બધી જગ્યાએથી સારા પ્રતિભાવો મળે છે.

આપણાં તાલીમાર્થીઓને એક મહિનો તાલીમ લે તેમને મોલમાંથી સ્ટાર્યપન્ડ મળેતો તાલીમાર્થીનો રસ જળવાઈ રહે અને ઉત્સાહથી તાલીમમાં આવે એ માટે વાત કરી હતી. હાઇપર સીટીના નિયમ પ્રમાણે તેઓ સ્ટાર્યપન્ડ ના આપી શકે પણ સેવાના તાલીમાર્થી છે માટે સારુ કામ કરનાર તાલીમાર્થીને તેઓ ગીફ્ટ વાઉચર આપશે એવી હાઇપર સીટીએ તૈયારી બતાવી.

સેન્ટ્રલ મોલમાં જુલાઈ- ઓગસ્ટ દરમયાન તાલીમાર્થીને મોકદ્યાં હતાં. આ મોલમાં ૫૦ જેટલો સ્ટાફ છે અને ત્યાં જે કસ્ટમર જાય એ ઓછામાં ઓછી ૧૦,૦૦૦ની વસ્તુઓતો ખરીદે જ. ત્યાં સ્ટાફ માટે નિયમો સ્ટ્રીક છે અને બહારના કોઇને તાલીમ આપતાં નથી પણ સેવાના લીધે તેઓ તાલીમ આપવા તૈયાર થયા, બીજું સંસ્થાઓ તાલીમાર્થીને મોકલેતો, ફી આપવી પડે. સેવા માટે ફી નહીં લે તેવું તેમણે સામેથી જ કહ્યું. ત્યાં તાલીમાર્થીને પહેલાં દિવસે કલાસરૂમ તાલીમ આપે અને જુદા જુદા વિભાગમાં મુકે અને તેમની સાથે સતત એક સીનીયર કાર્યકર સાથે હોય. આપણે જેટલાં દિવસ તાલીમાર્થી મોકલવા હોય એટલાં દિવસની તેમણે છુટ આપી છે.

બંને મોલે તાલીમ લીધાનું સર્ટીફિકેટ આપવા તૈયારી બતાવી છે, તાલીમાર્થીને સેવા અને મોલ બંને તરફથી એક કોમન સર્ટીફિકેટ આપવાનું વિચાર્યું.

## તાલીમ આપવા માટે પાસ થયાનું સર્ટીફિકેટ

તાલીમકારે આ તાલીમ આપવા માટે રાસ્કીની પરીક્ષા આપી તેમનું સર્ટીફિકેટ લેવું જરૂરી છે. તેના માટે રૂ. ૨૦૦૦/- ફી ભરવી પડે. જો પરીક્ષામાં પાસ ના થાપતો ફરી પરીક્ષા આપવી પડે અને એ વખતે ફરી રૂ. ૧૦૦૦/- રી ટેસ્ટના ભરવા પડે. તેમનું આપેલું સર્ટીફિકેટ એક વરસ સુધી માન્ય રહે. જો માસ્ટર ટ્રેનર તરીકે આગળ કામ ચાલું રાખતું હોય તો એ બહેને બીજા વરસે ફરીથી પરીક્ષા આપવી પડે. જેમની પહેલી તાલીમ થઈ એ વિષય બંનોએ આ પરીક્ષા આપી છે, જેમાં ૮ બહેનો પાસ થયા અને ૭ બહેનો નાપાસ થયા. તેમની ઇરણા છે કે તેઓ પરીક્ષા આપી માસ્ટર ટ્રેનર બને. માટે તેમને ફરીથી તૈયારી કરાવી આગામી ઓક્ટોબર માસમાં પરીક્ષા આપાવવાની છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના માનનીય મંત્રીશ્રીએ સેવામાં રીટેલ મેનેજમેન્ટની તાલીમ લઈને તૈયાર થયેલાં બે તાલીમાર્થીને ૧૫ જુલાઈ વિશ્વ યુવા કૌશાલ્ય દિનના રોજ સર્ટિફિકેટ આપી તેમનું ઉત્સાહવર્ધન કર્યું હતું.

## તાલીમાર્થી ડેટા બેઇઝમાં ટેકનોલોજીનો ઉપયોગ

આ કાર્યક્રમમાં ૩૬,૦૦૦ તાલીમાર્થીઓની માહિતી જેમકે કયા તાલીમાર્થીએ કયારે તાલીમ લીધી, કયાં ઓન ઘ જોબ તાલીમ લીધી, કયાં જોબ માટે ઇન્ટર બ્યુ આપ્યો, તેઓ ત્યાંજ કામ કરે છે કે છોડીને જતાં રહ્યાં તથા સેન્ટર દીઠ માસ્ટર ટ્રેનરે કેટલાં તાલીમાર્થીને કયારે તાલીમ આપી આ બધો ડેટા રાખવા માટે કોઈ નકકર સીસ્ટમ હોવી જોઈએ. શરૂઆતમાં કામ નાનું હોઇ તાલીમના ડેટા પહેલાં રજુસ્ટ્રેમાં નોંધતાં, ત્યારબાદ કોમ્પ્યુટરમાં વિગતો રાખતાં થયા ત્યારબાદ ગુગાલ ફોર્મમાં રાખવાનુંસરળ હોઇ તેમાં રાખવાનુંશરૂ કર્યું અને આમ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં થયા. આ માટે સોફ્ટવેર બનાવવા માટે જીલ્લા અને સહેરની ટીમો અને માસ્ટર ટ્રેનરો સાથે બેસીને કાર્યશાળા કરી અને નકકી કર્યું કે કયા કયા ડેટા હોવા જરૂરી છે. આ વિગતો એકપ્રિત કરવા એ પણ દચાનમાં રાખવામાં આવ્યું કે તાલીમાર્થી પાસેથી શું વિગતો ઇન્ટરબ્યુ વખતે લેવી અને કયા દસ્તાવેજો તેમની પાસેથી લેવા. આ ડેટા બેઇઝ તૈયાર કરવા માટે નિષ્ણાંતોની મદદ લીધી આ ડેટા જીલ્લા કક્ષાએ નોંધવાના છે અને દરેક જીલ્લાના ડેટા ઓન લાઈન સેવા મેનેજરની સ્કૂલ પાસે રહેશે. જીલ્લા કક્ષાએ નોંધવામાં અને સેવા મેનેજરની સ્કૂલ પાસે સેન્ટ્રલી રાખવામાં કેટું રહેશે તેની પ્રેક્ટીસ કરી ત્યારે પહેલી વાર જીલ્લાની બહેનોને અધર લાગ્યું અને તેમાં વિગતો એક બીજી સાથે જોડાએલી છે અને એક વિગત ના આવી હોય તો આગળ વધી ના જ શકાય ત્યારે એ સમજાયું કે તાલીમાર્થીનું રજુસ્ટ્રેશન થાય ત્યારે ચોકસાઈથી વિગતો લેવી પડશે. આ વિગતો નોંધવા માટે બીજી ગ્રામ વખત પ્રેક્ટીસ કરી ત્યારે હવે જીલ્લાની બહેનોને લાગ્યું કે અમે હવે આ કામ સરળતાથી કરી શકીશું.

## જીલ્લા અને અમદાવાદ શહેરના સેન્ટરો પર તાલીમ

સૌ પ્રથમ સાબરકાંડા જીલ્લાના તાલીમાર્થી તાલીમ લેવા માટે તૈયાર થયા. આ કાર્યક્રમની સૌથી પહેલી બેચ હતી. આમ તો તાલીમ જીલ્લા કક્ષાએ જ રાખવાની હોય ત્યાં કલાસરૂમ છે. જીલ્લામાં તાલીમ કરવા માટે કોઈને આત્મ વિશ્વાસ ન હતો રહેતો, માસ્ટર ટ્રેનર પણ ન હતાંઅને વળી ત્યાં મોલ નથી હોઇ તાલીમ સેવા મેનેજરની સ્કૂલના તાલીમ છોલમાં ગોઠવી હતી. અમદાવાદમાં પણ તાલીમ માટે ઘણી તૈયારી કરવી પડી જેમકે તાલીમાર્થીઓને રહેવાનું, જમવાનું, આટલાં મોટા શહેરમાં પહેલી વાર આવતાં હોઇ એ બાબતની જાણકારી વગેરે વગેરે. તાલીમાં પહેલાં દિવસે આટલું સંકલન કર્યું હતું બધાને સત ચિંતા હતી કે કેટલાં તાલીમાર્થી આવશે. બીજી તાલીમોમાં આમ ન થાય કેમકે સેવાની જાણીતી સભ્ય બહેનો આવે, આતો યુવાન બાળકો. તેઓનો મુડ ગડીક વારમાં બદલાઈ જાય. પહેલાં દિવસે ૧૫ તાલીમાર્થી આવ્યા અને ને દિવસ પછી બે તાલીમાર્થી પરત જતાં રહ્યા. પછીના દિવસોમાં ૧૩ તાલીમાર્થીઓ બધા દિવસ માટે આવ્યા. તાલીમ દરમાન જોગ્યું કે તેઓ પહેલાં દિવસે બહુ શરમાતા હતાં અને તેમનો અવાજ નિકળતો ન હતો. બીજા દિવસે વાતચીત કરવાની કળા અને રજુઆત કરવાની કળાની તાલીમાં તેમને બોલવું પડે એવી ઘણી એકસાઈઝ કરવાની હતી. તેઓ બીજા દિવસથી બોલતાં થયા. સત દિવસ દરમાન ઘણું પરિવર્તન તેમનામાં જોવા મળ્યું.

ઓન દ્વારા જોબ માટે હાઇપર સીટીમાં આ બેચ પહેલી જ હતી. ચિંતા થતી કે કેવી રીતે થશે. આપણાં માટે તાલીમાર્થી નવા, હાઇપર સીટીનું નવું જોડાણ અને તેમનું કામ કરવાની રીત, સમય અને કામ આપણાથી તદ્દન ભીજી પ્રકારનું. દરરોજ તેમની સાથે વાત કરી તેમના ફીડ બેક લેતાં. સાબરકાંઠા જીવલાના બે માસ્ટર ટ્રેનર્સ સતત તાલીમ દરમાન તાલીમાર્થીઓ સાથે રાત્રી રોકાણ કરતાં. બે બાળકોના માતા પિતા પણ તેમની સાથે એક બે વાર જોવા આવ છતાં.

હાઇપર સીટીની પ્રેક્ટીકલ તાલીમ દરમાન સીફુટમાં કામ કરવામાં તાલીમાર્થીને અધ્યરું લાગ્યું. તેમને આટલા કલાક ઊભા રહીને કામ કરવાની પ્રેક્ટીસ ન હોઈ બહું તકલીફ થતી. તેઓ જે દિવસે મોલમાં કામ કરવા ન જાય એ દિવસે સેવા મેનેજરની સ્કુલમાં કે મોલના જવાબદાર વ્યક્તિને તેની જાણ ન હતાં કરતાં. જેના માટે પાછળથી આપણાં મોલ તરફથી સાંભળું પડતું. તાલીમાર્થી સાથે વાત કરતાં જાણ્યું કે, તેમને બધાને એક સરખા સમર્યે કામ કરવા જરૂર હતું અને રજા પણ સાથે જ જોઈતી હતી. છોકરાઓને રાત્રે મોડા સુધી કામ કરવું ગમતું ન હતું. જે કોઈ તાલીમાર્થી ભાઈ કે બેન સારુ કામ કરે તેને હાઇપર સીટીમાંથી નોકરી કરવાની તક આપીશું એમ બીજા તાલીમાર્થીની સામે કહેતાં, જેથી અન્ય ભાઈ બહેનને થતું કે કેમ અમે સારુ કામ નથી કરતાં? બીજા જ દિવસથી તેઓનો મુડ બદલાઈ જતો કે કામ પર આવવાનું બંધ કરી દેતાં.

અમૃક તાલીમાર્થીના કિસ્સામાં એટું ચ બન્યું કે તેઓ જચાં રહેતાં હતાં એની આજુબાજુમાં રહેતા પડોશી જચાં કામે જતાં ત્યાં કામ કરવાનું આપણા તાલીમાર્થી ગોઠવતાં. એ વખતે સેવામાં ચિંતા થતી કે આ નાના અને નવા સવા છોકરાઓ પાસે કોઈક એટું કામ ન કરવતાં હોય જે પાછળથી તેમના માટે ચિંતાનો વિષય કે ભયજનક પુરવાર થાય અને તેમને વળતર કેટલું ચુકવે છે કામ અને કામના સંદર્ભમાં એ પણ જોવું પડે. નાના અને શહેરમાં નવા છોકરાઓને આ વાત ના સમજાય.

ત્યાર બાદ અમદાવાદ અને ગાંધીનગર જીવલાની તાલીમો ગોઠવાઈ, અમદાવાદના ચાર શાંતિપથ કેન્દ્રો પર તાલીમો ગોઠવાઈ. હાલમાં મહેસૂસાણા, આણાં અને બોડેલી જીવલમાં ઝાન વિઝાન કેન્દ્રો પર માસ્ટર ટ્રેનર તાલીમ આપે છે. અત્યાર સુધી ----- તાલીમાર્થી તાલીમ લઈ ગયા છે.

રી ટેલ મેનેજમેન્ટની તાલીમ હતી આથી તાલીમ ખુરશી ટેબલ પર બેસાડીને જ આપવી એમ નકકી કર્યું અને આ માટે જે કેન્દ્રો પર આ વ્યવસ્થા ન હતી તેમણે એ ગોઠવણ કરી છે.

## પડકારો

- સેવા માટે નવો વિષય હોઈ તાલીમ આપવા માટે વિષયની બારીકાઈથી જાણકારી કોઈને જ ન હતી.
- તાલીમ આપવા માટે મોડયુલ બનેલું ન હતું કે નકકી થયેલાં કોઈ વિષયો ન હતાં. તેને જાતે જ બનાયું અને ફાઈનલ કરવામાં લાંબો સમય લાગ્યો. ટીમને કોન્ફીડિન્સ ન હતો આવતો કે આ બરાબર હશે કે નહીં.
- તાલીમ આપવા અને જીવલાખોમાં તાલીમ આગામ ધ્યાવણ માટે માસ્ટર ટ્રેનર ન હતા અને તેના માપદંડો મળવા અધરાં હતાં. માટે બહેનોને વારંવાર તૈયાર થવા અમદાવાદ આપે એવો આગ્રહ રાખવામાં આવતો.
- દરેક સેન્ટર પર તાલીમાર્થી મળે પણ તાલીમ લેવા ૧૫ દિવસ જેટલાં લાંબા સમય માટે અમદાવાદ તાલીમ લેવા આવવા તાલીમાર્થી તૈયાર ન હતાં. આટલાં મોટા શહેરમાં રહેવાનું અજુગતું લાગતું અને અમદાવાદમાં રહેવાનો ખર્ચ ધારો વધી જાય એ તેમના માટે તકલીફદારક લાગ્યું. બીજા

જીવલામાં આટલાં બધાંને એકસાથે મોલમાં ઓન ઘ જોબ તાલીમ આપી શકાય એ શકાય ન હોઈ અમદાવાદ તાલીમ લેવા આવે એવો આગ્રહ રખાતો.

- તાલીમાર્થી પરંદ કરવા જતાં ત્યારે નકકી કરેલાં માપદંડ મુજબના તાલીમાર્થી મળવા મુશ્કેલ હતું.
- શી ટેલ દોપ્રમાં કામ કરવા માટે થોડું ધણું અંગેજુ અને હિન્દી બોલતાં અને સમજતાં આવડતું જોઈએ, ગ્રામીણ વિસ્તારના બાળકોની ગુજરાતી ભાષાના ઉચ્ચારણો પણ બરાબર નથી હોતા એમાં બદલાવ લાવવા માટે થોડી ધીરજ રખવી પડે.
- સેવાના વર્ષોથી તાલીમ સાથે જોડાએલા માસ્ટર ટ્રેનર માટે આ નવા પ્રકારની આવડત કેળવવાની વાત હતી, તેઓની માસ્ટર ટ્રેનર તરીકે પરંદગી ના થાય તો તેમને અને જીવલા સંચાલકોને સમજાવતું અધર હતું.
- ગ્રામડાંમાં રહેતા યુવાન છોકરાં છોકરીઓને મોલમાં કામ કરવા તૈયાર કરવા મુશ્કેલ છે, કારણકે આટલી મોટી જગ્યા, જુદુ વાતાવરણ, અમૃક રીતભાત, વર્ટિશંકાને શિસ્ત કયારેય જોઈના હોય એટલે એ વાતાવરણમાં ગુંગાણામણા અનુભવાય અને તેઓ ડર પણ અનુભવતાં.
- તાલીમાર્થીમોલમાં કામ શીખવા માટે જાય ત્યારે ત્યાંની રીતભાત સમજાવી હોય એ રીતે પર્તન કરવા તૈયાર થાય અને ખરેખર કામ શીખવા જાય ત્યારે શિસ્ત ના જાળવે, આ બાબતો તેમના માટે સામાન્ય હોય કે ના ઇરછા થઇ મોલમાં નકકી કરેલાં સમયે ના ગયા, પણ તેની ગંભીરતા તેઓ ના સમજે. બાળકોને પોતાના અનુકૂળ સમયે કામ કરવું હોય તથા આટલી મહેનત અત્યારસુધી કયારેય ના કરી હોય એટલે એ પણ તેમને અધર પડે. તેમને સમજાવીને ફરી કામે માકલવા એ બેચ ચાલતી હોય એ દરમ્યાનનું એક મોટું સમય માંગી લે એવું કામ થઇ જાય.
- દરેક જીવલાના તાલીમાર્થીની વિષયને ગ્રહણ કરવાની ક્ષમતા અલગા અલગા હોય એથી એ પ્રમાણે સમય વધારે ફાળવવો પડતો. જેમકે અમદાવાદ અને ગાંધીનગરના બાળકો બીજા જીવલાના બાળકોની સરખામણીમાં વધારે સ્માર્ટ હતાં અને આદિવાસી અને અંતરીયાંત ગામના બાળકો બરાબર સમજે એ માટે વધારે પ્રયત્નો કરવા પડે.
- અમદાવાદ શહેરમાં નોકરીની જરૂરીયાત હોય એવા ધણા યુવાનો અને યુવતીઓ છે પરંતુ તેઓ ૧૦ પાસ નથી ભણેલાં અને જેઓ ૧૦ કે ૧૨ પાસ છે તેઓ વિચારે છે કે અમે ઊભા ઊભા મજૂરી કેમ કરીએ. આઠ ધોરણ પછી ભણવાનું થોડી દીધું હોય એવા યુવાનો ધણાં છે જેમને તકની જરૂર છે.

### નાંનું શું શીખ્યા ?

- અસંગાઈટ વર્ગના બહેનોના પ્રશ્નો અને તેના માટેની કામગીરી કરતાં આ એકદમ અલગ જ બાબત છે, આ દુનિયા એકદમ અલગ છે એ સમજ્યાં.
- નવા વિષયને સમજુને મોડયુલ બનાવવાનું અને તાલીમ આપવાનું સ્લીકાર્યુ અને શરૂ કર્યુ.
- બ્યક્કિંગાત સાફ સફાઈ અને દેખાવનું મહત્વ છે રીટેલની દુનિયામાં એ સમજ્યા અને શીખ્યા જેમાં સેવાના મુદ્યોને દચાનમાં રાખીને પોતાનાં કપડાં અને દેખાવ હોવા જોઈએ.
- તાલીમાર્થીઓમાં તાલીમ દરમ્યાન ધણા ફેરફાર જેવા મળ્યાં. જે તાલીમાર્થી પગ ટર્સડીને ચાલતાં હતાં તેઓ પગ ઉપાડીને ચાલતાં થયા. જે ભાઈઓ દરરોજ દાઢી ન હતાં કરતાં તેઓ દાઢી કરીને આવતાં થયા. સ્લીપરના બદલે બુટ પહેરીને આવતાં થયા.

- ઓન દ જોબ તાલીમ પછી તાલીમાર્થી સેવામાં મળવા આવે તો ગુડ મોર્નિંગ અને મેડમ હાઉં આર યુ કહેતાં થઈ ગયા.
- તાલીમાર્થીના સ્ટીફિકેટ અને અન્ય જરૂરી દસ્તાવેજો અગાઉ આવી જાય એ સિવાય તાલીમ શરૂ નાઈ જ કરવાની એવા કડક બનતાં શીખ્યા.

## માસ્ટર ટ્રેનર- તાલીમાર્થીનો અનુભવ

શહેરી સંગાઠનના રેખાબેને કહ્યું કે, “આ તાલીમ મારા માટે નવી જ હતી. મારા ધરમાં કાચના વાસણો વેચવાનો ધંધો છે. મારા ભાસી શાકભાજુ પેચે છે. હું દિવાળી વખતે ખોળીયા બનાવીને પેચું છું અને મારા પતિ સીઝનલ ધંધો થણો બાંધીને કરે છે. અને સી.જી.રોડ પર અમારો થળો છે અમારા ગ્રાહકો મોટા ધરના લોકો છે. મારી નસે નસમાં સેલ (વેચાણ)વસેટું છે અને સેવાની કાઉન્ટર વેચાણની તાલીમે સોનામાં સુગંધ ભેણવી. તાલીમની વાતો ઘરે જઈને કરતી તો મારા પતિએ એવું જ કહ્યું કે આપણા ધંધાના કાઉન્ટર પર તને જ બેસાડી દઇશ. મારી બેનો, ભાસી બધાંને હું આ તાલીમના પાઠ ભણાવીશ. અમદાવાદમાં સેવા શાંતિપથ કેન્દ્રો પર તાલીમ આપીશ.”

બાયડના રૂપાબેને કહ્યું કે, “આ તાલીમ મને જરા જુદા પ્રકારની લાગી. આમતો તાલીમમાં ખિયરી શીખવાની હોય પણ આ તાલીમમાં તો પ્રેક્ટીકલી જુદા જુદા પ્રકારના મોલમાં જઈને શી ખવાળું અને પછી આવી જ તાલીમ જુલ્લાના ભાઇઓ બહેનો ને આપવાની. પહેલી વાર તાલીમ લીધી ત્યારે કોમ્પ્યુટર પર પરીક્ષા આપી. મોલની બહાર સીક્યોરીટીને જોઈને અંદર જતાં ખચકાટ થતો હતો. અમે ગુપમાં અંદર ગયા એટલે વાંધો ના આટ્યો. મોલના સ્ટાફે બહુ સરસ રીતે વાત કરી અને અમને વસ્તુઓ બતાવી. પહેલી તાલીમમાં રી ટેલ માટે તેચાર થવાનું છે એ ખબર હતી પણ મોલમાં ન હતા ગયા એટલે એમાં ઓછું સમજાયું. બીજુ તાલીમમાં મોલ અને બીજી રી ટેલ શોપનો બરાબર અનુભવ થયો અને સમજ પાકી થઈ. સાબરકાંઠામાં બાળકો ૧૦-૧૨ ધોરણ સુધી ભણીને ભણાવાનું છોડી દે છે અને ખેતી કરવામાં તેમને રસ નથી ત્યારે ‘ન ધર ના ન ધાટ ના’ જેવી પરિસ્થિતી થાય છે. આથી જો આવી તાલીમ લઈ તેઓને રોજગારી મળી જાયતો તેમની લાઇફ બની જાય.”

“સેવામાં આવીને મેં ત્ય પ્રકારની તાલીમ લીધી છે અને સેવા મેનેજરની સ્કૂલમાં માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ આપું છું. મેં જે તાલીમો લીધી તેના વિષયો જાણીતા હતાં જેમકે ખેતી, પણ પાલન. આ બધું તો ગામમાં જોતાં અને તેના વિશે શીખ્યા પણ આ રી ટેલ મેનેજમેન્ટ તો સાવ જ નવું મારા માટે!!! તેના વિશે કાંઈ જ ખબર ન હતી. પહેલાં અમને એક વખત મોલનો શૈક્ષણિક પ્રવાસ કરાયો ત્યારે પહેલી વાર મોલ જોયો. પહેલી વાર ગુમિંગ અને પ્લેટફોર્મ સ્કીલની તાલીમ થઈ હતી આ તાલીમ અંગ્રેજી ભાષામાં હશે એવો ડર હતો. તાલીમના નિયમો કડક હતાં, સમય લાંબો હતો, રાએ વાંચીને બીજા દિવસ માટે તેચાર થઈને આવતું પડતું, મોટી મોટી ચોપડીઓ વાંચવાની બહું અધાર લાગતું હતું. રાએ મારા પતિ મને ચોપડીઓમાંથી વાંચીને સમજાવતાં. કેટલી એ વાર રોતું આવી જતું. અને અધુરામાં પુર ઓન લાઇન કોમ્પ્યુટર પરીક્ષા આપવાની હતી. સમય ગયો તેમ તેમ બધું થાળે પડ્યું. તાલીમર્માંA'ગ્રેડના તાલીમકાર બનવા માટેની ધાણી નાની નાની બાબતો શીખવામાં આવી અમને. અમે અરવિંદ મીલ્સ, જુની એન્ડ જોની, લાફિઝ સ્ટાઇલ, વીલ્સના સ્ટોરમાં જતાં એવી શરમ આવી કે અમે સાવ સામાન્ય લાગીએ અને આટલા મોટા સ્ટોરમાં કેવી રીતે જવાય? આમાં તો મોટા ધરના

લોકો જ જાય. અંદર ગયા પછી ડર ભાગી ગયો, અમને સરખા જવાબો મળ્યા, તેમણે અમને કપડાં જોઈને નહીં પણ એક ગ્રાહક તરીકે ઓળખયા. આ મુલાકાતોમાં ધણું શીખ્યા. અમારે જાતે મોલ બનાવવાનો હતો ત્યારે અમે નાની નાની બાબતોનું દયાન રાખીને બધી ગોઠવણ કરી હતી. આમ મહેસાણા જીવલાના મીતાબેન સોલંકીએ જણાવ્યું.

અમદાવાદ જીવલાના દસકોઇ તાલુકાના રામપુર ગામના અભિતથાઇ રાઠોડ તાલીમ લેવા આવ્યા ત્યારે એમને એવું લાગતું હતું કે, હું સાત દિવસ તાલીમ લેવા કલાસરૂમમાં બેસી નહીં શકું, વરચેથી જ પાછો જતો રહીશ. તાલીમ પુરી થયા પછી તેમણે એવું કહ્યું કે, “તાલીમના ર દિવસ પછી મને એવું લાગ્યું કે આ તાલીમ ના લીધી હોય તો મોલમાં કામ કરવાનું અધરૂ લાગે. તાલીમમાં અમે વિષયોની સાથે સાથે સમયસર આવતું, કલાસમાં એક જણ બોલે ત્યારે વરચે બોલતું નહીં, હાથ ઉચ્ચો કરી બોલવાની રજા માંગવી, રજુઆત કેવીરીતે કરવી, ગ્રાહકની સાથે કયારે અને કેવીરીતે વાત કરવી વગેરે શીખ્યા. આટફા મોલ જોઈને હું તો જોતો જ રહી ગયો. મોલમાં ગ્રાહક વસ્તુ ખરીદતાં પહેલાં બરાબર ચકાસીને ખરીદે છે આમ કરવાથી તેમને ખરીદીમાં વિશ્વાસ આપે છે એની સાથે સાથે મોલમાં કામ કરતાં વ્યક્તિત્વે જે તે વસ્તુ વિષે પુરતી માહિતી હોવી જોઈએ જો જવાબ બરાબર ના આપી શકીએ તો ગ્રાહક પરત જાય છે આ બધી બારીકાઇ મને તાલીમ દરમ્યાન સમજાઇ.

“હું પૈશાલી ભાથીભાઇ પગી છું. અરવલ્લી જીવલાના માલપુર ગામમાં રહું છું. મેં ૧૦ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે ગામમાં જ અભ્યાસ કર્યો પણ બહુ મોટા શહેરમાં કદી ગયા ન હતાં. મોલ તો બહુ દુરની વાત છે. અમારી તાલીમ અમારા જીવલામાં જ ગોઠવાની હતી પણ છેવટે અમદાવાદ આવવાનું થયું. મારા મમ્મીની ઘરછા જ ન હતી કે હું અમદાવાદ જઉ પણ પણાના લીધે આવી શકી. તાલીમમાં ધણું બદ્ય નહીં પણ બદ્ય જ નાંતું શીખ્યા. શરૂઆતના બે પ્રણ દિવસનો હું સાવ ગુપ્તાયુપ બેસી રહેતી પછી ધીરે ધીરે બોલતી થઇ. અમને તૈયાર કરવામાં માસ્ટર ટ્રેનરનો મોટો ફાળો છે. રોલ પ્લે કરવામાં અમારો આત્મવિશ્વાસ વદ્યો. કોમ્પ્યુટર પર કોઇ દિવસ બેઠી ન હતી પણ ઓન લાઇન પરીક્ષા આપી એ મારા માટે બહુ મોટી સિદ્ધી હતી. હાઇપર સીટીમાં તાલીમ દરમ્યાન કલાસરૂમનું ભણેતું તાજુ થયું. ત્યાં ખરેખર ગ્રાહક સાથે વાત કરવી પડી અને મોલમાં કપડાંની ગોઠવણ કરતાં આવડયું. મને રીટેલ કોન્ટ્રાક્ટ કામ મળેતો હું ખરેખર જઉ.”

ભાનુમતીબેન અમદાવાદમાં રહેછે, તેમણે છુટાછેડા લીધા છે અને માતા સાથે રહે છે. તેમની મા સેવામાં છેલ્લા ૨૦ વરસથી સેવાની સર્વ્ય છે. મા દીકરી બંને ફેક્ટરીમાં કામ કરે છે. તેમણે કાર્યકમની જાણકારીની મિટીગમાં રીટેલની તાલીમ વિશે જાણ્યું. અને તેને આ તાલીમમાં ભાગ લેવાની ઘરછા થઇ. તેમણે જણાવ્યું કે, મને તાલીમમાં આવતાં ડર લાગતો હતો કે હું શું શીખીશ. તાલોમમાં જુદી જુદી પ્રવૃત્તિમાં ભાગ લેતી વખતે શરમાતી. પણ મેં નકકી કર્યું કે મારે મારો ડર ભાંગવો જ પડશે, મારે મારા કુટુંબમાં મદદ કરવાની જ છે. હુંમોલમાં તાલીમ લેવા ગઈ ત્યાં સુધી તો બહુ બદલાઇ ગઈ હતી. ઓન ધ જોબ તાલીમ લીધા પછી મેં ઘંટર બ્યુ આપ્યું અને મને જેબ મળી ગઈ.

મારું નામ પીનકી છે. હું મારા મમ્મી પણા, બે બહેનો અને ભાઈ સાથે ગાંધીનગર જીવલાના મોટી આદરજ ગામમાં રહું છું. જેતી અમારી આજુવિકા છે. હું મોટાભાગે ધરકામ કરું અને જેતરમાં થોડી ઘણી મદદ કરું. ગાંધીનગર જીવલાના કાર્યકર્તા ભારતીબેને એક મિટીગમાં રી ટેલ મેનેજમેન્ટની તાલીમની વાત કરી મને તાલીમમાં જોડાવાની ઘરછા થઇ. સાત દિવસની કલાસરૂમ તાલીમમાં જે શીખી એ જીવનમાં ઉપયોગી થશે એવું લાગ્યું. ગ્રુમીગ, વાતચીતની કળા, રજુઆતની કળાની તાલીમથી મારો આત્મવિશ્વાસ વદ્યો છે. રીટેલનું શીખ્યાં તેમાં કસ્ટમર અને કન્ઝયુમર, પિઝ્યુઆલ મર્યેન્ડાઇનીગ, ગ્રાહક સાથે કેવું વર્તન કરવું,

કચારે વાત કરવી એ આંખો ખોલી નાંખે એવી તાલીમ હતી. તાલીમ દરમાન વારંવાર રોલ પ્લે અને ઇન્ટર બ્યુ આપવાનું શીખ્યા, જેનાથી હેઠે મને લાગે છે કે હું હેઠે કોઇ પણ ઇન્ટર બ્યુ આપી શકીશ.

મોલમાં તાલીમ લેવાં ગઈ ત્યાં મને જે કામ સૌખ્યું હતું એ હું સારી રીતે કરી શકી. કલાસમાં શીખી હતી એટલે થોડો આત્મ વિશ્વાસતો આવી જ ગયો હતો. હું ગ્રામદાંમાં રહું છું અને અમારે ત્યાંની સંસ્કૃતિ શહેર કરતાં જુદી પડે, મને ધણી તકલીફો આવી પણ મારે તો મારા કુટુંબ માટે કંઈક કરી છુટ્ટું હતું એટલે આ બધાં પર દરમાન ન આપતાં હું શાંતિથી મારું કામ જ કરતી રહી. આ તાલીમે મારા માટે રોજગારીની નવી તકો ઉલ્લી કરી છે. રી ટેઇલ મેનેજમેન્ટની તાલીમે મને નવી દિશા આપી છે. હું એટું વિચારું છું કે મારે કંઈક અલગ જ કરવું છે. મારા ધરના સર્વો મને પુરે પુરો સહકાર આપવા તત્પર છે.

## ઉપસંહાર

આમ તો સેવાને દરેક કામમાં સંદર્ભમાંથી પસાર થતું જ પડે છે. નવી પેટીની સાથે વારંવાર મળીને તેમની જરૂરીયાત સમજી તેમને આગળ લાવવા સર્જ થઈને ડગતો માંડયાં છે. કાર્યકમને એક વરસ થઈ ગયું આ વરસ દરમાન ઘણું શીખ્યા અને હેઠે પરિસ્થિતીનો સામનો કરી શકાય એવી જગ્યાએ પહોરચાં છીએ પરંતુ છેવટનું એક માત્ર લક્ષ્ય એ રહેશે કે યુવા વગને તેમના મનગમતાં કામ મળે અને સેવામાંથી એવા તૈયાર થઈને જાય કે તેમને કોઇ એમ ના કહે કે આમનામાં આ આવડત નથી. અસંગાઠિત વગના સેવાની બહેનોએ ખુબ સંદર્ભ કર્યા ધર ચલાવવા અને બાળકોને ભણાવવા માટે. હેઠે બાળકોનો વારો છે કંઈક શીખીને કરી બતાવાનો. તાલીમ લઈને ગયેતાં બાળકો રી ટેલ ક્ષેત્રમાં જોબ મેળવી શકે કે ના શકે, પણ તેઓ સેવામાંથી એવા તૈયાર થઈને જશે કે, તેઓ નાના મોટા સ્ટોરમાં કામ મેળવી શકશે. પોતાના માતા-પિતાના ચાલુ ધંધામાં નવીનતા લાવી શકશે અથવા પોતાના નવા ધંધાને સારી રીતે જમાવી શકશે.

## નિદાનો

૧. તાલીમાર્થીઇન્ટરબ્યુનું ફોર્મેટ
૨. તાલીમાર્થી બાયો ડેટા ફોર્મેટ
૩. તાલીમ કાર્યકમની રૂપરેખા
૪. તાલીમાર્થી ડેટા બેઇઝ ફોર્મેટ
૫. રોટી કાર્યકમ વિશે સમજ આપવાનું પ્રેગનટેશન
૬. રોટી કાર્યકમ વહીવટી માળખાંનોકલો ચાર્ટ
૭. રોટી કાર્યકમ પ્રોસેસ ફલો ચાર્ટ
૮. તાલીમની વિગતો



